

This Question Paper contains 12 printed pages.  
(Section - A, B, C & D)

Sl.No. 297653

**18 (G)**  
(MARCH, 2024)

*Time : 3 Hours]*

*[Maximum Marks : 80]*

સૂચનાઓ :

- 1) સ્પેષ વંચાય તેવું હસ્તકેખન જાળવું.
- 2) આ પ્રશ્નપત્રમાં ચાર વિભાગ A, B, C અને D તથા 1 થી 54 પ્રશ્નો છે.
- 3) બધા જ વિભાગો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે.
- 4) પ્રશ્નની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે.
- 5) સૂચના પ્રમાણે આકૃતિઓ સ્વર્ચ, સ્પેષ અને પ્રમાણસર દોરવી.
- 6) નવો વિભાગ નવા પાના પર લખવો. પ્રશ્નોના જવાબ ક્રમમાં લખવા.
- 7) કેલ્યુલેટર, સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચનો ઉપયોગ કરવો નહિ.

વિભાગ - A


- સૂચના મુજબ જવાબ આપો : (પ્રશ્નક્રમાંક : 1 થી 24) (દરેક સાચાં ઉત્તરનો 1 ગુણ) [24]
- નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો.  
(પ્રશ્નક્રમાંક : 1 થી 6) (દરેકનો 1 ગુણ)

- 1) કિચ્ચલ મુરેખ સમીકરણ યુદ્ધમાં  $\frac{a_1}{a_2} \neq \frac{b_1}{b_2}$  હોય, તો તેના ઉકેલ \_\_\_\_\_ હોય છે. [1]  
(A) એક  
(B) બે  
(C) ત્રણ  
(D) ઉકેલ રાક્ય નથી.

- 2) જો \_\_\_\_\_ થાય તો દ્વિધાત સમીકરણ  $ax^2 + bx + c = 0, (a \neq 0)$  ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય. [1]
- (A)  $b^2 - 4ac < 0$       (B)  $b^2 - 4ac = 0$   
 (C)  $b^2 - 4ac > 0$       (D)  $b^2 - 4ac \neq 0$
- 3) કોઈ સમાંતર શ્રેણી  $4, 10, 16, 22, \dots\dots$  માટે સામાન્ય તફાવત (d) \_\_\_\_\_ છે. [1]
- (A) 8      (B) 5  
 (C) 6      (D) 12
- 4) બિંદુઓ  $(0, 5)$  અને  $(-5, 0)$  વચ્ચેનું અંતર \_\_\_\_\_ છે. [1]
- (A) 5      (B)  $5\sqrt{2}$   
 (C)  $2\sqrt{5}$       (D) 10
- 5)  $\sec^2 \theta - \tan^2 \theta = \underline{\hspace{2cm}}$ . [1]
- (A) 0      (B) 1  
 (C) -1      (D) 2
- 6) કોઈ માહિતી માટે  $\bar{X} = 25$  અને  $Z = 25$  તો  $M = \underline{\hspace{2cm}}$ . [1]
- (A) 25      (B) -25  
 (C) 5      (D) -5
- નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો  
 (પ્રક્રિકમંક : 7 થી 12) (દરેકનો 1 ગુણ)
- 7)  $3 + 2\sqrt{5}$  એ \_\_\_\_\_ સંખ્યા છે. (સંમેય, અસંમેય, ઋણપૂર્ણક) [1]
- 8) દ્વિધાત બહુપદી  $4x^2 - 3x - 7$  ના શૂન્યોનો સરવાળો \_\_\_\_\_ છે.  $\left(\frac{3}{4}, \frac{4}{3}, \frac{7}{3}\right)$  [1]
- 9) એક સિક્કાને નાણ વખત ઉછાળતાં મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા \_\_\_\_\_ છે. (4, 6, 8) [1]

- 10)  $\tan \theta \cdot \cot \theta = \underline{\hspace{2cm}}$ . (-1, 0, 1) [1]
- 11) વર્તુળને વધુમાં વધુ \_\_\_\_\_ સમાંતર સ્પર્શક હોઈ રહે. (1, 2, 3) [1]
- 12) -2, -3, 0, 1, 3, 2, 7 નો મધ્યરથ \_\_\_\_\_ છે. (-2, 1, 3) [1]
- નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. (પ્રશ્નક્રમાંક : 13 થી 16) (દરેકનો 1 ગુણ)

- 13) 17, 23 અને 29 નો ગુ.સા.અ. 1 છે. [1]
- 14) આકૃતિમાં કોઈ બહુપદી  $y = p(x)$  નો આદેખ આપેલ છે. આ કિર્સામાં  $p(x)$  ના શૂન્યોની સંખ્યા 2 છે. [1]



- 15) દ્વિચલ ભુરેખ સમીકરણ યું  $2x + 3y = 12$  અને  $3x + 2y = 18$  હોય તો  $x + y = 5$  થાય. [1]
- 16) અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય (0) છે. [1]

- નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપો. (પ્રશ્નક્રમાંક : 17 થી 20) (દરેકનો 1 ગુણ)

17)  $a, 2a, 3a, 4a, \dots$  સમાંતર શ્રેણી છે કે નહિ?

[1]

18) વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે?

[1]

19) પાસાને એક વખત ઉછાળતાં 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી?

[1]

20) પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો.

[1]

- નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો : (પ્રશ્નક્રમાંક : 21 થી 24) (દરેકનો 1 ગુણ) [4]

અ	બ
21) અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ	(a) $2\pi rh$
22) 5 ઢાયાના સિક્કાનું ધનફળ	(b) $\pi r^2$ (c) $\pi r^2 h$

અ	બ
23) $\theta$ ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ	(a) $\pi d$
24) વર્તુળનો પરિધ	(b) $\pi r$ (c) $\frac{\pi r \theta}{180}$

વિભાગ - B

- નીચે આપેલ 13 (તેરી) પ્રશ્નોમાંથી કોઈપણ 9 (નવ) પ્રશ્નોના ગણિતરી કરી જવાબ આપો.  
 (પ્રક્રિયાકારક : 25 થી 37) (દરેકના 2 ગુણ)

25) દ્વિઘાત બહુપદી  $x^2 + 7x + 10$  નાં શૂન્યો શોધો. [2]

26) દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે  $-\frac{1}{4}$  અને  $\frac{1}{4}$  હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. [2]

27) દ્વિઘાત સમીકરણ  $x^2 - 3x - 10 = 0$  નો અવયવીકરણની રીતથી ઉકેલ શોધો. [2]

28) સમાંતર શ્રેણી  $2, 7, 12, \dots$  નું 10 મું પદ શોધો. [2]

29) પ્રથમ 1000 ઘન પૂર્ણક સંખ્યાઓનો સરવાળો શોધો. [2]

30) બિંદુઓ  $(2, 3)$  અને  $(4, 1)$  વચ્ચેનું અંતર શોધો. [2]


31) બિંદુઓ  $P(2, -3)$  અને  $Q(10, y)$  વચ્ચેનું અંતર 10 એકમ હોય તો,  $y$  ની કિંમત શોધો. [2]

32)  $\sin \theta = \frac{4}{5}$ , તો  $\cos \theta$  અને  $\tan \theta$  ની કિંમત શોધો. [2]

33) કિંમત શોધો : [2]

$$\sin 60^\circ \cos 30^\circ + \sin 30^\circ \cos 60^\circ$$

- 34) જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેધકોણનું માપ  $60^\circ$  છે, તો ટાવરની ઊંચાઈ શોધો. [2]
- 35) બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી<sup>3</sup> હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબધનનું ઘનફળ શોધો. [2]
- 36) એક જ્યૂસ વેચવાવાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના ખાલામાં જ્યૂસ આપતો હતો. નળકાર ખાલાનો અંદરનો વ્યાસ 5 સે.મી. છે, પરંતુ ખાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો. જેથી, ખાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો ખાલાની ઊંચાઈ 10 સે.મી. હોય, તો તેની આભાસી ક્ષમતા શોધો. ( $\pi = 3.14$  લો) [2]



- 37) કોઈ વર્ગીકૃત માહિતી માટે  $n = 53$ ,  $l = 60$ ,  $cf = 22$ ,  $f = 7$ ,  $h = 10$  હોય તો મધ્યस્થ શોધો. [2]

વિભાગ - C

- નીચે આપેલા 9 (નવ) પ્રશ્નોમાંથી કોઈપણ 6 (ઇ) પ્રશ્નોના ગણાતરી કરી જવાબ આપો (પ્રશ્નક્રમાંક: 38 થી 46) (દરેકના 3 ગુણા) [18]

38) નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુઝનો ઉકેલ આદેશની રીતે મેળવો. [3]

$$2x + 3y = 11$$

$$2x - 4y = -24$$

39) નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુઝનો ઉકેલ લોપની રીતે મેળવો. [3]

$$3x - 5y - 4 = 0 \text{ અને } 9x = 2y + 7$$

40) 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂણીકોનો સરવાળો શોધો. [3]

41) AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર (2, -3) છે અને B(1, 4) છે તો બિંદુ A ના યામ શોધો. [3]

42) બિંદુઓ (4, -1) અને (-2, -3) ને જોડતા રેખાખંડનાં ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. [3]

43) સાબિત કરો કે, “વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે.” ? [3]

44) બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 41 સે.મી. અને 40 સે.મી. છે મોટા વર્તુળની જવા નાના વર્તુળને સ્પર્શી છે, તો તેની લંબાઈ શોધો. [3]

- 45) નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. [3]

ઉંમર (વર્ષમાં)	5-15	15-25	25-35	35-45	45-55	55-65
દર્દીઓની સંખ્યા	6	11	21	23	14	5

ઉપર આપેલ માહિતી માટે બહુલક રોધો.

- 46) એક ગલ્લામાં 50 પૈસાના સો સિક્કા, ₹1 ના પચાસ સિક્કા, ₹2 ના વીસ સિક્કા અને ₹5 ના દસ સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઉંઘો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય, તો સિક્કો [3]

- i) 50 પૈસાનો સિક્કો હોય.
- ii) ₹5 નો સિક્કો નહિ હોય.
- iii) ₹1 નો સિક્કો હોય તેની સંભાવના કેટલી?

- નીચે આપેલા 8 (આડ) પ્રશ્નોમાંથી કોઈપણ 5 (પાંચ) પ્રશ્નોના માઝ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો (પ્રશ્નક્રમાંક : 47 થી 54) (દરેકના 4 ગુણ) [20]

- 47) સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. [4]

- 48) 90 સે.મી. ઉંચાઈવાળી એક છોકરી વીજળોના થાંભલાના તળીયેથી 1.2 મી/સે.ની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો ચાર સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ રોધો. [4]

- 49) એક કાટકોળા વિકોળનો વેધ તેના પાયા કરતાં 7 સે.મી. નાનો છે જો કર્ણની લંબાઈ 13 સે.મી. હોય, તો બાકીની બે બાજુનાં માપ રોધો. [4]

50) ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7 મા વર્ષે 700 ટીવી બનાવ્યાં છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો [4]

- i) પ્રથમ વર્ષનું ઉત્પાદન
- ii) 10 મા વર્ષનું ઉત્પાદન
- iii) પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો.

51) નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરકનો દૈનિક ધરણથ્યું ખર્ચ બતાવે છે. [4]

દૈનિક ખર્ચ (₹ માં)	100-150	150-200	200-250	250-300	300-350
પરિવારોની સંખ્યા	4	15	12	2	2

પરિવારના ખોરક પરના દૈનિક ધરણથ્યું ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો.

52) જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યस્થ 28.5 હોય તો  $x$  અને  $y$  નાં મૂલ્યો શોધો. [4]

વર્ગ-અંતરાલ	આવૃત્તિ
0 - 10	5
10 - 20	$x$
20 - 30	20
30 - 40	15
40 - 50	$y$
50 - 60	5
કુલ	60

53) સરખી રીતે ચીપેલાં 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે, તો [4]

- લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું
- લાલનો ગુલામ
- કાળા રંગનો એક્કો હોય
- એક્કો ન હોય મળવાની સંભાવના શોધો.

54) તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર (arrow) હોય છે. તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. (આકૃતિ જુઓ) અને આ સમસંભાવી પરિણામો છે. [4]

- તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી?
- અયુઝ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી?
- 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી?
- 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી?

